


# જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત.



એ-૩, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઈ-૨, સુરત, (ISO 9001:2008 Certified)

Phone No: (0261) 2662903, Fax No: 2662902,

Email Id:suratdeo@gmail.com

જા.નં./કાનુની જાગૃતિ કાર્યક્રમ/૨૦૨૧ / ૧૩૮૫૯

તા. ૬ / ૧૦ / ૨૦૨૧

પ્રતિ,

આચાર્યશ્રી,

ગ્રાન્ટેડ મા. અને ઉ. મા. શાળાઓ


સુરત જિ. સુરત.

**વિષય :** તા. ૦૨.૧૦.૨૦૨૧ થી ૧૪.૧૧.૨૦૨૧ દરમિયાન કાનુની જાગૃતિના કાર્યક્રમો કરવા બાબત.

**સંદર્ભ :** જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, સુરતના પત્ર ક્રમાંક : ૨૫/૮૪૨/૨૦૨૧,  
તા. ૦૧/૧૦/૨૦૨૧

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે સુરત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની જાગૃતતા લાવવા અંગેનો પત્ર અત્રેની કચેરીને મળેલ છે. સંદર્ભ દર્શિત પત્ર મુજબ શૈક્ષણિક કાર્યને બાધ ન આવે તેવી રીતે કાનુની શૈક્ષણિક શિબિરનું આયોજન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, સુરત દ્વારા કરવાનું જણાવેલ છે.

ઉક્ત વિષય અન્વયે આપની શાળામાં સંદર્ભપત્ર મુજબની સંસ્થા તરફથી આવનાર કર્મચારી/અધિકારી દ્વારા કાનુની શિક્ષણ શિબિરનું આયોજન બાબતે આપશ્રીની સંપર્કમાં રહી શિબિરનું આયોજન કરનાર હોઈ તેઓને આપની શાળાનું શૈક્ષણિક કાર્યને બાધ ન આવે તે રીતે આયોજનમાં મદદરૂપ થવાનું રહેશે.

  
જિલ્લા શિક્ષણાધિકારી,  
સુરત. જિ. સુરત.

મલ કે. વ્યાસ  
ધક્ષ, જિલ્લા કાનૂની  
સેવા સત્તામંડળ અને મુખ્ય  
જિલ્લા ન્યાયાધિશ, સુરત.

75  
Azadi Ka  
Amrit Mahotsav



સર્વને સમાન ન્યાય

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત.  
સાતમો માળ, જિલ્લા ન્યાયાલય, અઠવાલાઈન્સ,  
સુરત - ૩૯૫ ૦૦૭.

ફોન અને ફેક્સ નંબર : ૨૬૫૧૮૦૪

E-mail Id : dlsa.sur-gj@nic.in

તારીખ : ૦૫ - ૧૦ - ૨૦૨૧.

જિ.કા.સે.સ.મં. સુરત./૨૧ /૮૪૨/૨૦૨૧.

પ્રતિ,  
જિલ્લા શિક્ષણઅધિકારીશ્રી,  
જિલ્લા શિક્ષણઅધિકારીશ્રીની કચેરી,  
સુરત.

વિષય :- તા.૦૨.૧૦.૨૦૨૧ થી તા.૧૪.૧૧.૨૦૨૧ દરમિયાન કાનૂની જાગૃતિ ના કાર્યક્રમો કરવા  
બાબત.

સંદર્ભ :- ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના પત્ર ક્રમાંક ૧૮૬૯/૨૦૨૧ તારીખ  
૨૪/૦૮/૨૦૨૧ અન્વયે.

સાહેબશ્રી,

સવિનય ઉપરોક્ત વિષય તથા સંદર્ભિત પત્ર અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે, ન્યાય એ દરેક સુસંસ્કૃત રાષ્ટ્ર માટેની આધારશિલા તથા મૂળભૂત ધ્યેય છે. કાયદાનો મુખ્ય હેતુ ન્યાય છે જે કોઈપણ સમાજની સુવ્યવસ્થિત પ્રગતિનું પ્રતિબિંબ છે. પાયાની કાનૂની તથા નાગરિક સ્વતંત્રતાનું, માનવ અધિકારોનું, બંધારણીય નિર્દેશો કે જે લોકોની ગરિમા તથા સ્વતંત્રતાનું રક્ષણ કરે છે, તેનું અજ્ઞાન પોતે જ સમાજમાં રહેતી સમસ્યાઓ સૂચવતું હોય છે. જેમ કે બાળમજૂરી, માનવ વ્યાપાર વિગેરે સ્વરૂપમાં કે જે તમામની સલામતી માટે ધમકીરૂપ છે. લોકોના પક્ષે રહેલી જાગૃતિના અભાવે કે જેઓના માટે જ કાયદાઓ ઘડવામાં આવે છે તથા કાયદા હેઠળના હકકો તથા વિશેષાધિકારોની અજ્ઞાનતાના કારણે, તેઓને પોતાની સાથે કશું ખોટું થયાનો કે કશું નુકશાન થયાનો ખ્યાલ આવતો નથી કે જેનું કાયદાકીય પ્રક્રિયા ધ્વારા નિરાકરણ થઈ શકતું હોય છે. આથી, લોકોમાં કાયદાકીય જાગૃતિ લાવવી સંપૂર્ણપણે જરૂરી છે. લોકોને દેશનાં કાયદાઓની જાણ હોવી જોઈએ. એ પણ વધારે મહત્વનું છે કે કાયદા વિષે યુવાનોને શિક્ષિત કરવામાં આવે કે જેથી તેઓનો કાયદાને વળગી રહેનારા નાગરિકો તરીકે ઉછેર થાય.

આ સ્થિતિમાં, શાળાઓ તથા કોલેજોમાં કાનૂની સાક્ષરતા મંડળો પાસેથી ફક્ત કાનૂની સાક્ષરતાને પ્રોત્સાહિત કરવા માટેની અપેક્ષા રાખવામાં જ નથી આવતી પરંતુ તે યુવાનોની માનવ અધિકારો તથા નબળી વસ્તી માટે ન્યાય મેળવવાની પહોંચની હિમાયત કરવાની ક્ષમતા પણ મજબૂત બનાવશે.

માર્ગ  
21/8/21

21/8/21



ઉપરોક્ત ધ્યેયને પાર પાડવા માટે અત્રેની સંસ્થા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, નામદાર ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ તરફથી મોકલાવવામાં આવેલ ઓકશન પ્લાન મુજબ દરેક માસમાં શાળાઓમાં કાયદા વિષેના જ્ઞાન માટે કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરે છે. જેના ભાગરૂપે તા.૦૨.૧૦.૨૦૨૧ થી તા.૧૪.૧૧.૨૦૨૧ દરમિયાન પણ આવી શિબિરોનું આયોજન કરવા માટે નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, નામદાર સર્વોચ્ચ અદાલત, ન્યુ દિલ્હી તરફથી જણાવવામાં આવેલ છે.

જેથી ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં રાખી આપશ્રીના તાબા તળે આવતી તમામ સ્કૂલોમાં અત્રેની ઓથોરીટી ધ્વારા કાનૂની શિક્ષણ શિબિરો કરવાનું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે ત્યારે તેવી શાળાઓ ધ્વારા આવી શિક્ષણ શિબિરો કરવા માટે યોગ્ય સમય અને તારીખ ફાળવવામાં આવે તેવો આદેશ કરવા વિનંતી છે કે જેથી કરીને અત્રેની કચેરી ધ્વારા આવી શિબિરોનું આયોજન કરવામાં કોઈ અડચણ ઉભી ન થાય.

વધુમાં અત્રેની કચેરી ધ્વારા આવી કાનૂની શિક્ષણ શિબિરો કરતી વખતે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓનું શિક્ષણ કાર્ય ન બગડે અને શાળાને કોઈ અડચણ ઉભી ન થાય તેની તકેદારી રાખવામાં આવશે જેની ખાતરી આપવામાં આવે છે.

આ અંગેનો તમામ શાળાઓને આદેશ કરતો પરીપત્ર/કચેરી હુકમ કરવામાં આવે તેની એક નકલ અત્રે મોકલાવવા વિનંતી કે જેથી કરીને આવી શિબિરોનું આયોજન કરતી વખતે સદરહું પરીપત્ર/કચેરી હુકમની નકલ જે તે શાળાને મોકલી શકાય.

આભાર સહ,

✓-✓-✓  
( વિમલ કે. વ્યાસ )

અધ્યક્ષ,

જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ  
અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ, સુરત